



Axel Polymers Limited

Regd. Office & Works : 309, Mokshi, Sankarda-Savli Road, Tal. Savli,
Dist. Vadodara - 391780, India. • Telefax : +91-2667-244395, 244438
info@axelindia.com • www.axelindia.com • CIN : L 25200GJ1992PLC017678

07.08.2020

To,
The Listing Department,
BSE Limited,
Floor 25, P. J. Towers,
Mumbai 400 001
BSE Scrip Code: - 513642

Dear Sir/Madam,


Sub: Publication of notice of 28th Annual General Meeting and E-voting information

Pursuant to Regulation 30 read with Schedule III Para A and Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and in compliance with Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of Companies (Management and Administration) Rules, 2014, the Secretarial Standard on General Meetings issued by the Institute of Company Secretaries of India, please find enclosed copies of the newspaper advertisements informing dispatch of Annual Report 2019-20 and the Notice of the 28th Annual General Meeting of the Company scheduled to be held on Friday, 28th August, 2020 at 10.00 a.m. (IST) through Video Conferencing / Other Audio Visual Means only and details relating to e-voting facility, published today in Business Standard and Loksatta Jansatta .

Kindly take the same on your record.

Thanking you,

For Axel Polymers Limited


Jigardan Gadhvi
Company Secretary



- Encl. 1. Business Standard - Ahmedabad Edition – English Language
2. Loksatta Jansatta - Gujarati Newspaper - English language

CONTIL INDIA LTD.

(CIN : L65909GJ1994PLC023444)

Regd. Off: 811, Siddharth Complex, R.C.Dutt Road, Alkapuri, Baroda - 390 007

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULT FOR THE QUARTER ENDED JUNE 30, 2020.

SR. NO.	PARTICULARS	Rs. (in 000)		
		QUARTER ENDED 30/06/2020 UNAUDITED	QUARTER ENDED 31/03/2020 AUDITED	QUARTER ENDED 30/06/2019 UNAUDITED
1	Total Income from Operation	24562.21	20061.69	20216.73
2	Net Profit/(loss) for the Period (Before Tax, Exceptional and/or Extraordinary Items#)	790.21	1601.16	277.73
3	Net Profit/(loss) for the Period Before Tax (After Exceptional and /or Extraordinary Items#)	790.21	1601.16	277.73
4	Net Profit/(loss) for the Period After Tax (After Exceptional and /or Extraordinary Items#)	790.21	621.36	277.73
5	Total Comprehensive Income for the Period (Comprising Profit / (loss) for the Period after Tax and other Comprehensive Income (After Tax))	790.21	-5792.29	277.73
6	Equity Share Capital	30944.00	30944.00	30944.00
7	Earning Per Share (of Rs. 10.00 each for Continuing & discounting Operations)			
	1. Basic	0.26	0.20	0.09
	2. Diluted	0.26	0.20	0.09

NOTE: (1) The above unaudited result as reviewed by the audit committee were taken on record by the Board of Directors at their meeting on 30/07/2020. (2) figures have been regrouped whenever necessary. (3) The company is mainly engaged in the business of Mechant Export Trading. (4) The Revenue from operations included the appropriate other income. (5) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Result are available on the websites of the Stock Exchange and the listed entity. www.contilgroup.com

DATE : 30-07-2020
PLACE : BARODA**CONTIL INDIA LTD.**
K.H. CONTRACTOR (DIRECTOR)**Rapicut Carbides Limited**

Regd. office & Works : 119, GIDC Industrial Area, Ankleshwar - 393002 Gujarat

Tele : (02646) 221071, 251118 CIN : L28910GJ1977PLC002998

Email : investors@rapicutcarbides.com Website : www.rapicutcarbides.com

NOTICE TO SHAREHOLDERS**TRANSFER OF EQUITY SHARES TO INVESTOR EDUCATION AND PROTECTION FUND (IEPF)**

Provisions of Section 124(6) of the Companies Act, 2013 read with Rule 6 of Investor Education and Protection Fund (IEPF) Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2017, inter-alia provide for transfer of all shares in respect of which dividend has not been claimed by the shareholders for seven consecutive years to the Investor Education and Protection Fund set up by the Central Government. The Company has communicated to concerned shareholders whose shares are liable to be transferred to IEPF at their latest available addresses and uploaded details of such shareholders on its website at www.rapicutcarbides.com/finance.htm. Shareholders may access the website to verify details of the shares liable to be transferred to IEPF.

Shareholders concerned may make an application to the Company/Registrar by 15th October, 2020 with a request for claiming the unpaid dividend for the year 2012-13 onwards so that shares would continue to be registered in their names. If no reply is received by 15th October, 2020, the Company will transfer the shares to the IEPF without any further notice by following due process as under:

- In case of shares held in demat mode : by transfer of shares directly to demat account of IEPF Authority with the help of Depository Participants.
- In case of shares held in physical form : by issuing new share certificates and thereafter transferring the same to IEPF authority and in such cases original share certificates of these shareholders shall stand cancelled and will not exist.

Shares transferred to IEPF including all benefits accruing on such shares, if any, can be claimed from the IEPF Authority by filling E-form No IEPF-5 as prescribed under the said Rules.

For any query shareholders are requested to contact Secretarial Department of the Company Tel: 02646 251118, Email Id: investors@rapicutcarbides.com or Company's Registrar and Transfer Agents at M/s Sharex Dynamic India Pvt Ltd, Tel: 022 28515606/5644, Email Id: support@sharexindia.com

Date : 06/08/2020
Place : Ankleshwar**For Rapicut Carbides Limited**
Kamlesh M Shinde
Company Secretary**ORIENT ABRASIVES LIMITED**

Regd. Office: GIDC Industrial Area, Porbandar - 360577 (Gujarat).

Tel. No.: + 91- 286-2221788 Fax: + 91-286-2222719

Website: www.orientabrasives.com,

Investors Relations E-mail ID: investor@oalmail.co.in

CIN No.: L24299GJ1971PLC093248

Extract of Unaudited Financial Results for the First Quarter ended 30th June, 2020
(Rs. in Lacs)

SR. NO.	PARTICULARS	Quarter ended		
		30-06-2020	30-06-2019	Year ended 31-03-2020
		Unaudited	Unaudited	Audited
1.	Total Income from Operations	6,247.31	8,798.74	34,957.29
2.	Net Profit for the period / year before tax & exceptional items	269.96	664.45	2,760.08
3.	Net Profit for the period / year before tax	269.96	664.45	2,620.35
4.	Net Profit for the period / year after tax	216.14	559.16	2,055.91
5.	Total Comprehensive Income for the period / year (Comprising profit for the period / year (after tax) and Other Comprehensive Income (after tax))	210.29	561.93	1,991.99
6.	Equity Share Capital(Including Shares Forfeited Rs.0.13 Lacs)	1,196.52	1,196.52	1,196.52
7.	Reserves (excluding Revaluation Reserves as shown in the Balance Sheet of previous year)	22,055.41	20,985.83	22,055.41
8.	Earnings / Loss Per Share (EPS) (Rs.) (of Rs. 1/- each not annualised)			
	Basic	0.18	0.47	1.72
	Diluted	0.18	0.46	1.72

NOTES:

- The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of Orient Abrasives Limited ("the Company") at their respective meetings held on August 5, 2020, in accordance with the requirements of Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended. The Statutory Auditor has issued an unqualified Audit opinion on these results.
- These financial results of the Company have been prepared in accordance with the Companies (Indian Accounting Standard) Rules, 2015 (Ind AS) (as amended) prescribed under section 133 of the Companies Act, 2013 read with relevant rules issued thereunder and Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended.
- Impact assessment - COVID-19**
The COVID-19 pandemic outbreak and measures to curtail it has caused significant disturbances and slowdown of economic activities. The Company's operations (including manufacturing at Porbandar) were impacted in the quarter, due to scaling down / suspending production due to supply chain constraints, shortage of workforce and with a view to ensure safety across all areas of operations. Following the approvals received from the government authorities, the Company has commenced operations w.e.f. April 15, 2020 and the operations in the month of May and June have been sub-optimal due to general economic scenario. The Company has considered the possible impact of COVID-19 in preparation of the above results. The impact of the global health pandemic may be different from that estimated as at the date of approval of these financial results and the Company will continue to closely monitor any material changes to future economic conditions.
- Investor complaints received - Nil during the Quarter ended June 30, 2020 and disposed - Nil. Closing Balance - Nil.

By Order of the Board
For Orient Abrasives Limited
Sd/-
Manubhai Rathod
Whole-Time Director & CEO
(Din: 07618837)

Place : Porbandar
Date : August 5, 2020

APAR INDUSTRIES LIMITED
(CIN : L91110GJ1989PLC012802)

Registered Office : 301, Panorama Complex, R. C. Dutt Road, Vadodara - 390 007 (Gujarat), India.

Tel. No. : (0265) 2339906 Fax : (0265) 2330309 E-mail : com_sec@apar.com URL : www.apar.com

EXTRACT OF UN-AUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE, 2020

Particulars	Consolidated		
	Quarter ended		Year ended
	30th June, 2020	30th June, 2019	31st March, 2020
	(Reviewed)	(Reviewed)	(Audited)
Total Income from operations (Gross)	1,292.98	1,981.58	7,461.74
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	(30.63)	64.43	169.41
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)	(30.63)	64.43	169.41
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and / or Extraordinary items)	(23.07)	41.24	135.15
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax))	33.83	15.58	51.71
Equity Share Capital	38.27	38.27	38.27
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet			1,128.16
Earnings Per Share (Face Value of ₹ 10/- each) (for continuing and discontinued operations)			
Basic and Diluted	(6.03)	10.78	35.32

Notes :

- The said Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at its Meeting held on 6th August, 2020.
- Additional information on Standalone financial results is as follows :**

Particulars	Quarter ended		
	30th June, 2020	30th June, 2019	31st March, 2020
	(Reviewed)	(Reviewed)	(Audited)
Total Income from Operations (Gross)	1,222.83	1,867.53	7,060.09
Profit before tax	(27.86)	65.28	171.67
Profit for the period	(20.67)	42.13	138.98
Total Comprehensive income (after tax)	36.03	16.96	51.40

- The above is an extract of the detailed format of Statement of standalone and consolidated financial results filed with the Stock Exchanges pursuant to Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Statement of standalone and consolidated financial results are available on the Stock Exchange websites www.bseindia.com (Scrip Code 532259) and www.nseindia.com (Scrip Symbol - APARINDS) and on Company's website www.apar.com.

Place : Mumbai
Date : 6th August, 2020

For Apar Industries Limited
Sd/-
Kushal N. Desai
Chairman & Managing Director
DIN : 00008084

IN THE HIGH COURT OF JUDICATURE AT MADRAS

(Ordinary Original Civil Jurisdiction)

Application No. 389 of 2019

In the matter of Arbitration & Conciliation Act, 1996 And in the matter of Disputes between M/s. Cholamandalam Investment and Finance Company Ltd. and Mr. Chhagan Valu Koli & another arising under Loan Agreement No. XVFPGD00000867155 Dated 11.12.2012.

M/s. Cholamandalam Investment and Finance Company Limited, "Dare House", No.2, N.S.C. Bose Road, Parrys, Chennai - 600 001. Represented by its Authorised Signatory. : Applicant

Vs.

1. Mr. Chhagan Valu Koli S/o. Valu Koli AT - Vidli, TA - Anjar, Kutch, Gujarat - 370110

2. Mr. Valu Mengha Koli S/o. Mengha Koli AT - Vidli, TA - Anjar, Kutch, Gujarat - 370110 : Respondents

To

1. Mr. Chhagan Valu Koli S/o. Valu Koli AT - Vidli, TA - Anjar, Kutch, Gujarat - 370110

2. Mr. Valu Mengha Koli S/o. Mengha Koli AT - Vidli, TA - Anjar, Kutch, Gujarat - 370110.

The Hon'ble High Court, Madras on 01.06.2020 was pleased to pass an order in the above application directing you to furnish security to the extent of the claim of a sum of Rs. 2,66,133/- On 31.07.2020 the Hon'ble High Court was pleased to order paper publication returnable by 28.08.2020. The above application is posted on 28.08.2020 before the Hon'ble High Court, Madras. Kindly take notice and appear either in person or through an Advocate and furnish security.

M/s. D. PRADEEP KUMAR Counsel for Applicant

E-Auction Sale Notice

(Sale of the Properties under Insolvency and Bankruptcy Code, 2016)

Shri Aster Silicates Limited (in Liquidation)

CIN: L01403GJ1996PLC030581

Registered office: Plot No. 831, B/h J.M. Huber Chemicals, Jhagadia GIDC, Jhagadia, Dist. Bharuch Gujarat 393 110

Liquidator's details: Divyesh Desai, B2 402B Marathon Innova, Off Ganpatrao Kadam Marg, Lower Parel, Mumbai 400013

Email ID: divyeshdesai@singhico.com and Tel No.:+91 (0) 22 66625537/24952881

Sale of the below mentioned properties owned by Shri Aster Silicates Limited (in Liquidation), being in the possession of the Liquidator forming part of the Liquidation Estate by the Liquidator, appointed by the Honorable National Company Law Tribunal, Ahmedabad bench vide order dated 1st October, 2019. The said property will be sold on "As is where is basis", "As is what is basis", "Whatever there is basis" and "No recourse" basis for recovery of debts under Insolvency and Bankruptcy Code, 2016. The sale will be done by the undersigned through public e-auction platform of E-Procurement Technologies Ltd-Auction Tiger at https://mctauction.auctiontiger.net on September 09, 2020 from 2.00 PM to 3.00 PM with unlimited extensions of 5 min each.

ASSET(S) TO BE AUCTIONED AND RESERVE PRICES

Assets	Block	Reserve Price in INR lacs	EMD Amount in INR lacs	Incremental Value in INR lacs
Land, Building and Plant & Machinery of Kheda Unit	A	100.00	10.00	0.50
Building Structure and Plant & Machinery of Kheda Unit	B	40.00	5.00	0.25
Land, Building and Plant & Machinery of Jhagadia Unit	C	700.00	25.00	1.00
Building Structure and Plant & Machinery of Jhagadia Unit	D	300.00	10.00	1.00

The Terms and Conditions document containing bid form, declaration form etc. with respect to the E-auction are available on https://mctauction.auctiontiger.net. For further clarifications, please contact the undersigned.

Place : Mumbai
Date : 6th August 2020
IBBI registration No. IBBI/IPA-001/IP-P0169/2017-2018/10338sd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidatorsd/-
Divyesh Desai
Liquidator

Jay SPEAKS

Business Standard
Insight Out

To book your copy, call 022-40275432 or SMS reachbs to 57575 or email us at order@bsmail.in

www.business-standard.com

For Axel Polymers Limited

Date: 06.08.2020

Place: Vadodara

Jigardan Gadhavi, Company Secretary

sd/-

sd/-

sd/-

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગોઝારી ઘટનાની તપાસ માટે ત્રણ અધિકારીની નિયુક્તિ કરી

અમદાવાદ, તા. ૬ નવરંગપુરામાં આવી શ્રેય હોસ્પિટલમાં સાંધેગાની અલ્ટ્રાસાઉન્ડિંગમાં આગ લાગતા આઠ દર્દીઓ બંધીને બંધાયું હતું. આ ગોઝારી ઘટનામાં રાજ્યના મુખ્યમંત્રીએ ૩ દિવસમાં તપાસ તેમજ તાર્કિક આધાર મેળવવાનું કાર્ય આજીવન સુધી આપવાનું જણાવ્યું છે. આ સાથે પીએમએએલ ટ્રિસ્ટ કરી જણાવ્યું છે કે, પીએમએલ ટ્રિસ્ટ મુકાબલે ને લાભ અને ઉજ્જવલતાને પ્રયાત હજારની સહાયની જાહેરાત કરી છે. આ દુર્ઘટના તપાસ માટે રાજ્યના વરિષ્ઠ આઈએએસ અધિકારી ત્રણ વિભાગના અધિક મુખ્ય સચિવ નીલકાંઠા સિંઘ અને હરદેવી વિહાર વિભાગના અધિક મુખ્ય સચિવ સુલભ પૂરીની નિયુક્તિ

શ્રેય હોસ્પિટલ આગની તપાસ ૩ દિવસમાં પુરી કરવા આદેશ

અલ્ટ્રાસાઉન્ડ રાજ્ય સરકારને તાર્કિક આધાર આપવા આદેશ કરેલ છે. આ અંગે આરોગ્ય સચિવ જયંતિ સિંઘ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે અલ્ટ્રાસાઉન્ડ કરી, હાલ આ ઘટનાને લઈને મુખ્ય જ દુ:ખ છે, પરંતુ વધુ કોઈ મત ન થાય અને વિતા સત્તાથી રહી છે. આ ઘટનામાં જવાબદારો સામે કડક પગલાં લેવાશે. તમામ વસ્તુઓની તપાસ થઈ રહી છે. તપાસ કરવા અને પડતો નીચાઈ જાય ત્યાં જ તાર્કિક આધાર આપવા આદેશ કરેલ છે. રાજ્ય સરકારને તાર્કિક આધાર આપવા આદેશ કરેલ છે. આ અંગે આરોગ્ય સચિવ જયંતિ સિંઘ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે અલ્ટ્રાસાઉન્ડ કરી, હાલ આ ઘટનાને લઈને મુખ્ય જ દુ:ખ છે, પરંતુ વધુ કોઈ મત ન થાય અને વિતા સત્તાથી રહી છે. આ ઘટનામાં જવાબદારો સામે કડક પગલાં લેવાશે. તમામ વસ્તુઓની તપાસ થઈ રહી છે. તપાસ કરવા અને પડતો નીચાઈ જાય ત્યાં જ તાર્કિક આધાર આપવા આદેશ કરેલ છે.




૨૪ કલાકમાં નવા ૧૦૭૩ કેસ : સુરતમાં સૌથી વધુ કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દૈનિક રીતે વધતી જાય છે. સુરતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. ૨૪ કલાકમાં નવા ૧૦૭૩ કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દૈનિક રીતે વધતી જાય છે. સુરતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. ૨૪ કલાકમાં નવા ૧૦૭૩ કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દૈનિક રીતે વધતી જાય છે. સુરતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. ૨૪ કલાકમાં નવા ૧૦૭૩ કેસ નોંધાયા છે.

દુર્ઘટનાના પ્રચલકર્તા એવા હોસ્પિટલના વૈદ્ય લોચને ગોઝારી રાતની કલાની દર્શાવી

આગ નાની હતી પરંતુ ICUમાં બ્લાસ્ટ થતા સ્થિતિ વણસી ગઈ: ચિરાગ પટેલ

જે રૂમમાં બ્લાસ્ટ થયો તેનો દુમાડો એટલો જોરદાર હતો કે અમે લોકો કચ્છ પણ જોઈ શકતા ન હતા. આ ઘટનામાં જવાબદારો સામે કડક પગલાં લેવાશે. તમામ વસ્તુઓની તપાસ થઈ રહી છે. તપાસ કરવા અને પડતો નીચાઈ જાય ત્યાં જ તાર્કિક આધાર આપવા આદેશ કરેલ છે. આ અંગે આરોગ્ય સચિવ જયંતિ સિંઘ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે અલ્ટ્રાસાઉન્ડ કરી, હાલ આ ઘટનાને લઈને મુખ્ય જ દુ:ખ છે, પરંતુ વધુ કોઈ મત ન થાય અને વિતા સત્તાથી રહી છે.



હતો તેનો કચ્છો એટલો બધો હતો કે અમે લોકો કચ્છ પણ જોઈ શકતા ન હતા. આ ઘટનામાં જવાબદારો સામે કડક પગલાં લેવાશે. તમામ વસ્તુઓની તપાસ થઈ રહી છે. તપાસ કરવા અને પડતો નીચાઈ જાય ત્યાં જ તાર્કિક આધાર આપવા આદેશ કરેલ છે.

ઈન્કિસ્પુર આઉટ સેક્ટિંગ સિસ્ટમના વૈજ્ઞાનિકોએ અરલી વોર્નિંગ સિસ્ટમ વિકસાવી

ભૂકંપ જમીન પર સ્ટ્રાઈક કરશે તેની ૪૦ સેકન્ડ પહેલાં લોકોને એસએમએસથી એલર્ટ મળશે

લોકોને તેમના મોબાઈલ માથાને આધાર આપીને ૪૦ સેકન્ડ પહેલાં ભૂકંપ જમીન પર સ્ટ્રાઈક કરશે તેની ૪૦ સેકન્ડ પહેલાં લોકોને એસએમએસથી એલર્ટ મળશે. આ ઘટનામાં જવાબદારો સામે કડક પગલાં લેવાશે. તમામ વસ્તુઓની તપાસ થઈ રહી છે. તપાસ કરવા અને પડતો નીચાઈ જાય ત્યાં જ તાર્કિક આધાર આપવા આદેશ કરેલ છે.

રાજકોટમાં બપોર સુધી વધુ ૪૮ કોરોના કેસ પોઝિટિવ દર્દીનાં મોત

હવાના આરોગી વસીમ ઉર્ફે સકાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટ કોરોના કેસમાં નવો વધારો થયો છે. રાજકોટમાં બપોર સુધી વધુ ૪૮ કોરોના કેસ પોઝિટિવ દર્દીનાં મોત નોંધાયા છે.

Table with 2 columns: Relevant Particulars and Details. Includes information about the liquidation process of Brev Bryers Hospitality Private Limited.

દેવગઢ બારીસાને એ. સમ ડીવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં, ચીલોટિંગ બારીસા

અમી માનવમંદીરી કે.એ.બી.સી.આઈ.સી. પ્રમુખ જણાવે છે કે, અમારી સોસાયટીના રહીશ શ્રી સુભાષી દેવગઢ બારીસાને પંચોલી માલીક બંધવાયા છે. અમારી સોસાયટીના રહીશ શ્રી સુભાષી દેવગઢ બારીસાને પંચોલી માલીક બંધવાયા છે.

Axel Polymers Limited

NOTICE OF 20th ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION. The 20th Annual General Meeting of Axel Polymers Limited will be held on 20th August, 2020 at 10:30 AM.

રેપીડ કાર્બોઈડ્સ સિમિટેડ

૧૧૬, છાપાઈયા ઈન્ડસ્ટ્રીયલ એરિયા, અહિરવાડ ૩૬૩૦૦૨, ગુજરાત ફોન : (૦૨૨૭૩) ૨૨૪૦૧૧, ૨૨૫૧૧૮ CIN : L28190GJ1977PLC002998 Email : investors@rapicarbides.com Website : www.rapicarbides.com

M મુંગલ સોટો ઈન્વેસ્ટમેન્ટ લીમિટેડ

વિકાસ કો-ઓપરેટિવ (લીમીટેડ) /અને અન્યો (વિનયુક્ત મામલા) (ઓબીએસ) દ્વારા આયોજિત ૨૩મી વાર્ષિક સાધારણ સભા